

APM TERMINALS Lifting Global Trade.

Gujarat Pipavav Port Limited

Regd. Office: Pipavav Port, At Post Rampara-2 via Rajula, Dist. Amreli Gujarat 365 560
CIN: L63010GJ1992PLC018106
Tel: 02794 302400, Fax: 02794 302413
Website: www.pipavav.com, Email: investorrelation@pipavav.com

NOTICE

Pursuant to Regulations 29 and 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a Meeting of the Board of Directors of Gujarat Pipavav Port Limited (the Company) will be held on Thursday 6th February 2020, to consider inter-alia Un-audited Standalone and Consolidated financial results of the Company for the Quarter ended 31st December 2019.

The Notice is also available on the Company website www.pipavav.com and on the website of the Stock Exchanges www.bseindia.com and www.nseindia.com

For Gujarat Pipavav Port Limited

Date : 15th January 2020 Manish Agnihotri
Place : Mumbai Company Secretary & Compliance Officer

ECONOMY
FINANCIAL EXPRESS

RECENT NEWS

Charvaha DHAWARSHA INVEST LIMITED

NOTICE

LONDON TREES HOTELS LIMITED

NOTICE

PRUDENTIAL

Shree Cement

SUDARSHAN

NOTICE

Nippon Life India Asset Management Limited

NOTICE

Reliance

NOTICE

BJP received ₹1,450 cr via electoral bonds in FY19, Cong ₹583 cr, says ADR

APM TERMINALS Gujarat Pipavav Port Limited

NOTICE

Nippon Life India Asset Management Limited

NOTICE

SHREE PRECOATED STEELS LIMITED

CIN: L70109MH2007PLC174206

Regd Office: 1 Ground Floor Citi Mall, New Link Road, Andheri (W), Mumbai - 400 053
Tel: +91-7208182677 | Website: www.spsl.com | E-mail Id: spsl.investors@gmail.com

EXTRACT OF THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2019

Sr. No.	Particulars	Standalone		
		Quarter Ended	Nine Months Ended	Quarter Ended
		31-Dec-19 Unaudited	31-Dec-19 Unaudited	31-Dec-18 Unaudited
1	Total Income From Operations	5	26	74
2	Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional items)	(8)	(16)	38
3	Net Profit/ (Loss) for the period before Tax (after Exceptional items)	(8)	(16)	38
4	Net Profit/ (Loss) for the period after tax (after Exceptional items)	(8)	(16)	38
5	Total Comprehensive Income for the period (Comprehensive Profit/Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	-	-	-
6	Paid up Equity Share Capital	414	414	414
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	(389)	(389)	(8,241)
8	Earning per Share (of Rs.10 each) (for continuing and discontinued operations)			
1)	Basic	(0.19)	(0.39)	0.92
2)	Diluted	(0.19)	(0.39)	0.92

Notes:

- The above Un-audited financial results were reviewed by the Audit Committee and have been taken on record by the Board of Directors of the Company at its Meeting held on 6th February 2020 along with limited review report provided by the Statutory Auditors.
- This statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (IND AS) prescribed under Section 133 of Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent applicable.
- The results for the Quarter ended 31st December, 2019 are available on BSE Limited website (URL: www.bseindia.com/corporates) and on Company's website (URL: http://www.spsl.com/financial-results.php)
- The figures of the previous years have been regrouped/rearranged wherever necessary to conform current period's classification.

For Shree Precoated Steels Limited
SD/-
Harsh L. Mehta
Managing Director

MODI INDUSTRIES LIMITED Modinagar (Uttar Pradesh) PUBLIC NOTICE TO WHOMSOEVER IT MAY CONCERN

The present notice is being issued by Modi Industries Ltd. (MIL) to Public at large as well as the Promoters of MIL (including their group companies / affiliates / assignees / legal heirs including but not limited to Mr. Mahendra Kumar Modi & Mr. Manish Kumar Modi) in pursuance to a notice dated 04.02.2020 issued by SBEC Sugar Ltd. (a Umesh Modi Group Company), the registered debt holder of more than 85% of the secured debt of MIL by virtue of registered assignment deeds whereby apart from having charge over the entire assets of MIL (both immovable and moveable, which is registered with Registrar of Companies, Kanpur (Ministry of Corporate Affairs), the Promoters of MIL (including their group companies / affiliates / assignees / legal heirs including but not limited to Mr. Mahendra Kumar Modi & Mr. Manish Kumar Modi) have also given Undertaking(s) for non-disposal of shareholding in respect of shares of MIL by the Promoters of MIL (including their group companies / affiliates / assignees / legal heirs including but not limited to Mr. Mahendra Kumar Modi & Mr. Manish Kumar Modi).

The relevant portion of the said undertaking is "Not without your prior approval in writing, transfer, assign, dispose of, pledge, charge or create any lien in any way encumber my existing or future shareholding in borrowers capital in favour of any person (s) so long as money remain due by the borrower to you in respect of the said loan." Also, in the year 1975, a similar undertaking was given.

Substantial amount of money is outstanding and payable by MIL to SBEC Sugar Ltd. By way of the present notice, we have been directed by SBEC Sugar Ltd. to inform the Public at large as well as the Promoters of MIL (including their group companies / affiliates / assignees / legal heirs including but not limited to Mr. Mahendra Kumar Modi & Mr. Manish Kumar Modi) from transferring, assigning, disposing, pledging, creating a charge and / or lien, encumber any shares (whether in physical / dematerialised form) and / or directly or indirectly in any manner whatsoever including the right to vote directly or indirectly by way of proxy in respect of their shareholding, whether held by them directly and / or indirectly through group companies and / or subsequent transferees etc. in terms of the Undertakings for Non-Disposal of Shares given in the year 1975 & 1989 by the Promoters of MIL (including their group companies / affiliates / assignees / legal heirs including but not limited to Mr. Mahendra Kumar Modi & Mr. Manish Kumar Modi) given in favour of SBEC Sugar Ltd. which now stands extended in favour of SBEC Sugar Ltd. by virtue of Assignment of Debt.

It is hereby made clear that any person transferring, assigning, disposing, pledging, creating a charge and / or lien, encumber any shares (whether in physical / dematerialised form) and / or directly or indirectly in any manner whatsoever including the right to vote directly or indirectly by way of proxy in respect of shareholding of MIL will be doing so at their own risk and peril and any such transaction(s) / dealing(s) (written or oral) is void ab initio and any such transferee, assignee, pledgee, charge holder and / or any right holder will not be recognised by MIL and in any case such transaction(s) do not hold any legal sanctity in terms of the undertaking extended by the Promoters of MIL (including their group companies / affiliates / assignees / legal heirs including but not limited to Mr. Mahendra Kumar Modi & Mr. Manish Kumar Modi).

Any violation of the said Undertakings for Non-Disposal of Shares given in the year 1975 & 1989 shall not be recognised by MIL in any manner under any circumstances, whatsoever and those entities / individuals violating the same shall be liable for all the consequences, whether Civil or Penal.

Modi Industries Ltd.

PG ELECTROPLAST LIMITED

CIN: L32109DL2003PLC119416

Regd. Office: DTJ209, 2nd Floor, DLF Tower - B, Jasola, New Delhi - 110025
Ph: 91-120-2569323

Email: investors@pgeil.in Website: www.pgeil.in

NOTICE

Notice is hereby given that a meeting of Board of Directors of the Company has been scheduled on Friday, 14.02.2020 at 5:00 PM at Corporate office at P-4/2 to 4/6, Site B, UPSIDC Ind. Area, Surajpur, Greater Noida (U.P.) 201306 to, inter alia, consider & approve Unaudited Financial Results for the quarter ended on December 31, 2019.

This intimation is also available on Company's website - www.pgeil.in and may also be accessed at website of stock exchanges viz. BSE Limited at www.bseindia.com & National Stock Exchange of India Limited at www.nseindia.com.

Further, it is notified that window for trading in shares of the Company shall continue to remain closed till Sunday, February 16, 2020.

For PG Electoplast Limited
Sd/-
Place: Greater Noida (Vishal Gupta)
Date: 06.02.2020 Director

TRF LIMITED A TATA Enterprise

Regd. Office: 11, Station Road, Burmanines, Jamshepdr - 831 007

Phone No.: 0657-2345727

Email: comp_sec@trf.co.in

Cin: L74210JH1962PLC000700

NOTICE

Pursuant to Regulation 47(1)(a) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of TRF Limited will be held on Friday, February 14, 2020, inter alia, to consider and take on record:

- The audited standalone and unaudited consolidated financial results of the Company for the quarter and half-year ended September 30, 2019.
- The unaudited standalone and consolidated financial results for the quarter and nine months ended December 31, 2019.

The instant Notice is also available on the Company Website: www.trf.co.in and Stock Exchange(s) websites at: www.bseindia.com and www.nse-india.com. The result once declared will also be uploaded on the aforementioned websites.

For TRF LIMITED
Subhashish Datta
Company Secretary & Chief Commercial Officer
Dated: 06.02.2020

Sea TV Network Ltd.

Regd. Office: 148 MANAS NAGAR SHAHGANJ AGRA UP- 282010 IN
Tel: +91-562-4036666 Fax: +91-562-4036666

Website: www.seatvnetwork.com
CIN: L92132UP2004PLC028650

NOTICE OF BOARD MEETING

Pursuant to Regulation 33 and Regulation 47(1)(a) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 notice is hereby given that the Meeting of the Board of Directors of the Company is scheduled to be held at registered Office of the Company 148 MANAS NAGAR SHAHGANJ AGRA UP- 282010 IN on Friday 14th of February, 2020 at 10.00 P.M., to inter-alia consider and approve the Un-audited Standalone and Consolidated Financial Results of the Company for the quarter and nine months ended as on 31st December, 2019. Further details will be made available at the website of the company viz. www.seatvnetwork.com and the website of the stock exchange where the Company's shares are listed viz. www.bseindia.com

By Order of the Board
For, Sea TV Network Ltd.
Sd/-
SNEHAL AGARWAL
(Company Secretary & Compliance Officer)

Place: Agra
Date: February 06th, 2020

AKASHDEEP METAL INDUSTRIES LIMITED

CIN: L28998DL1983PLC017150

Registered Office: 14, Dayanand Vihar, Backside Ground Floor, Vikas Marg Extn., Delhi - 110092, Tel: +91-11-43011038. Email: info.akashdeep14@gmail.com

Website: www.akashdeepmetal.in

NOTICE

Notice is hereby given that a Meeting of the Board of Directors of the Company is scheduled to be held on 13th February, 2020 at 14, Dayanand Vihar, Backside Ground Floor, Vikas Marg Extn., Delhi-110092, inter alia to consider and approve, the Unaudited Standalone and Consolidated Financial Results of the Company for the Quarter and Nine months ended 31st December, 2019.

(This Notice is also available on the website of the Stock Exchange, where the shares of the Company is listed at www.bseindia.com and on Company's website at www.akashdeepmetal.in)

For Akashdeep Metal Industries Limited
Sd/-
Sachin Dagar
Company Secretary & Compliance Officer

Date : 06.02.2020
Place : Delhi

Whereas, Asset Reconstruction Company (India) Limited (hereinafter referred to as "Arcil") is an Asset Reconstruction company incorporated under the companies Act, 1956 and registered with the Reserve Bank of India under section 3 of Securitization and Reconstruction of Financial Assets and Enforcement of security interest Act, 2002 (hereinafter referred to as "the Act") and whereas the Borrower/ Mortgage/ Guarantors/ Co-Obligants & Consentors, as mentioned in column 3 of the below mentioned chart obtained loan from various banks and whereas Arcil has acquired the financial assets relating to the loan accounts mentioned in column 2 of the below mentioned chart and Whereas Arcil, being the secured creditor under the Act and in exercise of powers conferred under S. 13(2) of the said Act read with Rule 3 of the security interest (Enforcement) Rules, 2002, issued demand notice calling upon the Borrowers/Co-Borrowers/Guarantors, as mentioned in Column No. 3, to repay the amount mentioned in the notices with further interest thereon within 60 days from the date of notice, but the notices could not be served upon some of them for various reasons.

Sr. No.	Loan Account No.	Name of Borrower/ Co-Borrower/Guarantor	Total Outstanding (In Rs.) Total Due as on
1.	10215287837	Mr. Chhotey Lal / Mr. Satya Pal Singh / Mr. Shiv Kant	Rs. 3,27,816.11 06-Jan-2020
Collateral Property Address : Arazi / Plot (admeasuring-83.61 Sq. Mtrs) Part of Minjumla Number 414, Situated at Vake Mauja Nekpur, Pargana & Tehsil-bareilly, Uttar Pradesh in the name of Mr. Chhotey Lal S/o Sh. Ram Swaroop. Bounded By:- East- Rasta 10 Feet Wide, West-Arazi of Komi Prasad, North-Arazi Vaya, South -Arazi Vaya.			
2.	10418124496	Mr. Iqbal Hussain / Mr. Ram Dularey / Mr. Kadar Nath	Rs. 9,76,670.65 06-Jan-2020
Collateral Property Address : Arazi / Plot (admeasuring-125.41 Sq. Mtrs.) Part of Number's 780,794,796 To 799, Situated at Viji Sanaiya Rani Mewa Kurwar, Bareilly, Uttar Pradesh in the name of Mr. Iqbal Hussain S/o Mr. Lyaqat Hussain. Bounded By:- East-Rasta 10 Feet Wide, West-Wall Of Railway, North-House of Govind, South -Arazi Vaya.			
3.	7493	Mr. Raj Nath Sharma (Since Deceased) / Through Legal Heir Mr. Ravi Sharma / Smt. Asha Sharma / M/s New Ravi Vishal Beej Bhandar	Rs. 56,93,367.96 06-Jan-2020
Collateral Property Address : Plot No 2 Khasra No. 54 A and B (measuring 134.7 Sq Yds) at Radhey Vihar Colony Mauja-Dahora, Ward-Lohamandi, Tehsil And Dist-Agra, Uttar Pradesh in the name of Mr. Rajnath Sharma and Mrs. Asha Sharma. Boundries: East-Rasta, West-Land of Prem Singh, North-Plot No-3, South-Plot No-1			
4.	LBDEL00000 820219	Mr. Chaman Singh (Since Deceased) / Through Legal Heir's Smt. Sathiri Devi) & Mrs. Ritika Kumari & Mr. Shushil Kumar	Rs. 24,57,705.88 06-Jan-2020
Collateral Property Address : Free Hold Residential Plot No. 82/5, (64 Sq. Yards.) Situated At Residential Colony, Naveen Park, Vill- Bagaula, Pargana & Tehsil-District- Ghaziabad Uttar Pradesh in the name of Mr. Chaman Singh and Mrs. Sathiri Devi. Boundries: East-plot No.82/6, West-Plot No.82/4, North-block-Plot No.82/3, South-Rasta 10 Feet Wide.			
5.	HL0031/ HDLH00010455	Mr. Manoj Kumar / Mrs. Neelam / Mr. Ram Lubhaya / Mr. Madan Lal (Deceased) Co-Borrower Through Legal Heir(s) - Smt. Veena Mehra / Ms. Parul Mehra / Ms. Rajani Mehra	Rs. 42,74,072.41 12-Jun-2018
Collateral Property Address : Eastern Side Half Portion of Property Bearing Municipal Corporation No. WZ-243 (old) (Plot No 2 Khasra No. 54 A and B (measuring 134.7 Sq Yds) at Yids With Roof Rights, Plot No. 4 A, Out of Khasara No. 2741/610, Situated in the Colony Known as Sudarshan Park, Village-Basai Darapur, Delhi in the Name of Madan Lal S/o Tunda Ram and Mrs. Lubbhaya S/o Tunda Ram. Bounded As:- North- Lane-10, South- Road 20, East-Property No. C-23, West-Half Portion of the Said Property			
6.	SLPHDLH0000025 & SLPHDLH0000050	Mr. Garvit Singhal / Mrs. Lata Rani / Mr. Umesh Chand	Rs. 64,84,972.09 & Rs. 12,28,300.06 22-Jan-2020
Collateral Property Address : Commercial property being Shop No. 07 on ground floor (without roof rights) of property bearing Municipal Corporation No. 25, New No. 61 and now known as 136 (admeasuring 10.50 square yards), Kallupura, Dasna Road, Ghaziabad, Uttar Pradesh Boundaries: East-House of Mr. Lal Singh, West- Common Gallery of 10 ft., North - Shop No. 08, South - Shop No. 06 AND Residential and Commercial Plot Old No.25 & New No.69, total area of property on ground floor shop area being 22.64 sq. meter and first floor (residential) area being 31.35 sq. meter, Kallupura, Ghaziabad, Uttar Pradesh. Boundaries: East- House of Mr. Prem, West-Shop of Mr. Dinesh Kumar, North-Property of Mr. Dwarakadas & common gallery of 8.0 ft., South - House of Sallo.			

Notice, is therefore given to the Borrowers/Mortgagor/Guarantors/Co-obligants & Consentors, as mentioned in Column No. 3, calling upon them to make payment of the aggregate amount as shown in Column No. 4, against the respective Borrowers/Co-Borrower/ Guarantors/Co-obligants & Consentors, within 60 days of publication of this notice as the said amount is found payable in relation to the respective Loan account as on the date shown in Column No. 4. It is made clear that if the aggregate amount together with further interest and other amounts which may become payable till the date of payment, is not paid, Arcil shall be constrained to take appropriate action for enforcement of security interest upon properties as described above, steps are also being taken for service of notice in other manners as prescribed under the Act and the rules made here under.

Date: 07.02.2020
Place: Uttarpradesh

Sd/- Authorized Officer
Asset Reconstruction Company (India) Ltd

ASSET RECONSTRUCTION COMPANY (INDIA) LTD.

CIN NO:-U65999MH2002PLC134884 www.arcil.co.in

Registered Office: The Ruby, 10th Floor, 29 Senapati Bapat Marg, Dadar (West) Mumbai-400 028, Tel: +91 2266581300

Branch Address: Second Floor, Sethi Chambers Plot No.2, D.D.A. Local Shopping Centre, MORI and New Raibinder Nagar, New Delhi - 110060, 011-46370444

Sun Pharmaceutical Industries Limited

Regd. Office: SPARC, Tandajia, Vadodara - 390012, Gujarat, INDIA

Sun House, Plot No. 201 B/1, Western Express Highway, Goregaon (E), Mumbai - 400063
Tel: +91 22 4324 4324 CIN: L24230GJ1993PLC019050 Website : www.sunpharma.com

Extract of Unaudited Consolidated Financial Results for the Quarter and Nine Months ended December 31, 2019

Particulars	Quarter ended		Nine Months ended		Year ended
	31.12.2019	30.09.2019	31.12.2018	31.12.2018	31.03.2019
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
Total Income from operations	8,154.85	8,123.35	7,740.19	24,652.56	21,901.99
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	1,351.33	1,433.38	1,730.11	4,432.15	4,330.34
Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	1,351.33	1,433.38	1,730.11	4,432.15	3,115.96
Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	1,023.71	1,167.35	1,459.19	3,692.44	2,486.27
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,480.94	1,677.65	(630.35)	4,551.35	4,272.78
Equity Share Capital	239.93	239.93	239.93	239.93	239.93
Other Equity	N.A.	N.A.	N.A.	N.A.	41,169.13
Earnings Per Share (of ₹ 1/- each) (not annualised for quarters)					
₹ Basic:	3.81	4.43	5.18	14.03	8.46
₹ Diluted:	3.81	4.43	5.18	14.03	8.46

Notes:

- The above unaudited consolidated financial results of the Company have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on February 05, 2020 and February 06, 2020.
- Additional information on standalone financial results is as follows:

Particulars	Quarter ended		Nine Months ended		Year ended
	31.12.2019	30.09.2019	31.12.2018	31.12.2018	31.03.2019
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
Total Income from operations	3,013.55	3,373.29	2,261.26	9,695.85	7,751.08
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	478.01	839.63	(65.07)	2,085.78	947.65
Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	478.01	839.63	(65.07)	2,085.78	(266.73)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	468.76	823.16	(38.68)	2,055.29	(251.46)
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	451.53	788.88	(99.90)	1,995.62	(3.40)

The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results are available on the websites of the Stock Exchanges i.e. www.bseindia.com and www.nseindia.com and on the Company's website www.sunpharma.com.

For and on behalf of the Board
Dilip S. Shanghvi
Managing Director

Mumbai, February 06, 2020



AN INDIAN MULTINATIONAL COMPANY

23%
REVENUE

224%
EBITDA

Statement of Consolidated Un-audited Financial Results for the Quarter Ended 31st December, 2019 (₹ in Lacs)

S. No.	Particulars	Quarter Ended 31.12.2019 (Unaudited)	Quarter Ended 30.09.2019 (Unaudited)	Quarter Ended 31.12.2018 (Unaudited)	Nine Months Ended 31.12.2019 (Unaudited)	Nine Months Ended 31.12.2018 (Unaudited)	Year Ended 31.03.2019 (Audited)
1.	Total Income from operations (Net)	37,651.40	32,767.19	30,507.18	96,854.36	90,274.18	124,172.83
2.	Net Profit for the period (Before Tax, Exceptional and / or Extraordinary Items)	2,093.49	857.96	100.95	3,463.65	2,235.67	2,958.05
3.	Net Profit for the period before Tax (After Exceptional and/or Extraordinary Items)	2,093.49	857.96	100.95	3,463.65	2,235.67	2,958.05
4.	Net Profit for the period After Tax (After Exceptional and/or Extraordinary Items)	1,225.79	639.97	36.31	2,056.59	1,606.76	1,549.23
5.	Total Comprehensive Income for the period	1,269.19	717.30	(7.52)	2,194.24	1,747.36	1,620.22
6.	Equity Share Capital (Face value per share Rs 2/-)	1,380.76	1,380.76	1,374.93	1,380.76	1,374.93	1,374.93
7.	Reserves (excluding Revaluation Reserve)						18,557.15
8.	Earnings Per Share (After Tax & minority interest) (of Rs 2/- each)						
(a)	Basic:	1.54	1.17	0.05	2.99	2.34	2.26
(b)	Diluted:	1.54	1.17	0.05	2.99	2.33	2.25

Key Numbers of Un-audited Standalone Financial Results (₹ in Lacs)

1.	Turnover (Net Sales)	32,549.38	28,384.86	27,366.58	84,050.60	74,744.79	105,935.55
2.	Profit / (Loss) Before Tax	1,706.01	372.84	(100.35)	2,660.38	313.54	2,409.75
3.	Profit / (Loss) After Tax	1,060.97	267.13	(17.02)	1,736.72	359.67	1,895.29

Date : 05.02.2020
Place : Jaipur

By Order of the Board
For Gravita India Limited
Rajat Agrawal,
Managing Director
DIN : 00855284

Notes:

- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites viz. www.bseindia.com and www.nseindia.com. The same is also available on the company's website viz. www.gravitaindia.com.
- # - Exceptional and / or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules/As Rules, whichever is applicable.

Corporate Office : Gravita Tower, A-27B, Shanti Path, Tilak Nagar, Jaipur-302004 (Raj.). T: +91 141 4057700, Email: info@gravitaindia.com
Registered Office : "Saurabh" Chittora Road, Harsulia Mod, Digi-Malpur Road, Teh-Phagi, Jaipur-303904, (Rajasthan) India.
Web: www.gravitaindia.com, www.gravitaaluminium.com

